

આપના આરોગ્ય, કલ્યાણ અને
નાણા બાબતે નિર્ણયો લેવા...

તમે ન લઈ શકતા હોવ ત્યારે
કોણ નિર્ણય લે છે?



આ એક નવો કાયદો છે જે તમને
મદદ કરી શકશે.

તમને કોઈ બિમારી, ઈજા કે અશક્તતા છે જેને કારણે નિર્ણયો લેવામાં મુશ્કેલી અનુભવો છો?

તમે જેની સારવાર કરતા હોવ, જેની સામે કામ કરતા હોવ, અથવા કોઈને જાણતા હોવ કે જેને નિર્ણય લેવામાં મુશ્કેલી પડે છે?

ભવિષ્યમાં આપના પોતાના માટે મહત્વપૂર્ણ નિર્ણય ન લઈ શકો તેમ લાગતું હોય તો આપ કોઈ આગળ માટે આયોજન કરવા ઈચ્છો છો?

આ એક નવો કાયદો છે જે તમને મદદ કરી શકશે.

માનસિક ક્ષમતા અધિનિયમ 2005

આપણા જીવનની અનેક બાબતો અંગે દરરોજ આપણે નિર્ણયો લેતા હોઈએ છીએ. નિર્ણયો લેવાની કાર્યશક્તિને **માનસિક ક્ષમતા** કહે છે. લોકો કેટલાક નિર્ણયો લેવામાં બધા કે થોડાક માટે મુશ્કેલી અનુભવે છે. આવું બનતું હોય છે કારણ કે તેઓમાં:

- શીખવાની અશક્તતા
- મતિભ્રમ
- માનસિક આરોગ્ય સમસ્યા
- મસ્તકમાં ઈજા અથવા આઘાત

અને આપણામાંથી કોઈને ભવિષ્યમાં માનસિક ક્ષમતાની ઉણપ વર્તાતી હોય તો તે માટે આગળ માટે આયોજન કરી શકે, ઉદાહરણ તરીકે અકસ્માતને કારણે.

માનસિક ક્ષમતા અધિનિયમ, ઈંગ્લેન્ડ અને વેલ્સમાં એપ્રિલ 2007 થી અમલમાં આવે તેવું આયોજન કરેલું છે, અને તે આવી પરિસ્થિતિમાં લોકોને અસર કરી શકશે. તે તેમનાં પરિવાર, સંભાળ કરનાર, આરોગ્ય અને સામાજિક સંભાળ કર્મચારીઓ અને અન્ય માણસો જે તેમનાં સંપર્કમાં રહેતા હોય તેમને પણ અસર કરનાર હશે. તે એવા બધા જ મુખ્ય નિર્ણયો, કે જેના માટે વ્યક્તિ ક્ષમતાની ઉણપ અનુભવતી હોય, એવી બાબતો જેમ કે નાણાકીય, સામાજિક સંભાળ, તબીબી સારવાર અને સંશોધન વ્યવસ્થા, તેમજ રોજ-બ-રોજના નિર્ણયોની બાબતોને આવરી લેનાર હશે.

આ કાયદો સામાન્ય રીતે 16 વર્ષ અથવા એથી અધિક ઉપરનાં લોકોને લાગુ પડશે.

કાયદો તમને કેવી રીતે અસર કરશે

જો તમે કેટલાક નિર્ણયો લેવા અશક્તિમાન હોવ ત્યાં અધિનિયમ સમજાવે છે કે:

- તમે પોતાના નિર્ણયો લેવામાં શક્ય તેટલી વધુમાં વધુ સહાય મેળવી જોઈએ.
- તમે અમુક નિર્ણય અમુક સમયે લઈ શકવા શક્તિમાન છો કે નહીં તે માટેની તમારી ક્ષમતાનું મૂલ્યાંકન કેવી રીતે કરવું જોઈએ
- જો તમે કદાચ ખૂબ જ જટિલ નિર્ણય તમારા માટે ન લઈ શકતા હોવ તો એનો અર્થ એમ નથી કે તમે વધુ સીધાસાદા નિર્ણયો પણ લેવામાં અસમર્થ છો
- તમારી વતીથી જો અન્ય કોઈએ નિર્ણયો લેવાના હોય તો પણ તમારી તેમાં શક્ય તેટલી વધુ સામેલગીરી હોવી જોઈશે
- તમારી વતીથી નિર્ણય લેનારે તમારા હિતને શ્રેષ્ઠ પ્રાધાન્ય આપવું જોઈશે
- અહીં એક નવું રક્ષણાત્મક પગલું હાજર છે સ્વતંત્ર માનસિક ક્ષમતા એડવોકેટ (IMCA), જે, તમને તમારા કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવાની ક્ષમતામાં ઉણપ હોય તો તે અંગે તમારી રજૂઆત કરશે અને તમારે એના સિવાય કોઈની સલાહ લેવાની નથી.

તમે ભવિષ્ય માટે આગળનું આયોજન કરવા ઈચ્છતા હોવ તો આ અધિનિયમ :

- લાસ્ટીંગ પાવર ઓફ એટોર્ની (LPA) બનાવવાની મંજૂરી આપવાથી તમે ક્યારેય પણ તમારે માટે નિર્ણય લેવાની ક્ષમતામાં ઉણપ અનુભવો ત્યારે તમારી વતીથી તમારા નાણા અને મિલકત અથવા તમારા આરોગ્ય સંભાળ અને કલ્યાણ બાબતે કોઈ નિર્ણય લેનારની નિયુક્તિ કરવા સક્ષમ બનો છો.

- તમે ક્ષમતાની ઉણપને લીધે નકારી ન શકો ત્યારે કોઈ ખાસ તબીબી સારવાર લેવાની તમે ભવિષ્યના કોઈ સમયે લેવાની ઈચ્છા ન ધરાવતાં હોવ તો ‘સારવાર નકારવાનો આગોતરો નિર્ણય’ લેવા માટે સક્ષમ બનો છો

તમે પરિવાર કે કોઈ માનદ સંભાળકર્તા હોવ તો અધિનિયમ:

- કોઈકને નિર્ણય લેવાની ક્ષમતામાં ઉણપ હોય ત્યારે તેના વતી કેવી રીતે અને ક્યારે વર્તી શકો તે સમજાવવામાં તમને સહાય કરશે. – અને તમે આવું કરતા હોવ ત્યારે તેના રક્ષણાત્મક પગલાઓ અને મર્યાદાઓ
- વ્યવસાયિક પરામર્શકારો દ્વારા તમને સલાહસૂચન માટે કહેશે. ઉદાહરણ તરીકે, પરિવારનો સભ્ય જેને ક્ષમતાની ઉણપ હોય તેને માટે કોઈ ડોક્ટર તેની સારવાર અંગે નિર્ણય લે ત્યારે.

તમે આરોગ્ય અને સામાજિક સંભાળમાં કામ કરતા હોવ તો અધિનિયમ:

- તેઓને નિર્ણય લેવાની ક્ષમતામાં ઉણપ હોય તો વ્યક્તિની માનસિક ક્ષમતાના મૂલ્યાંકન અને તેમનાં ઉત્તમ હિતોને મુકરર કરવા માટે માળખું પૂરું પાડે છે.
- તમને રક્ષણાત્મક પગલાં અને મર્યાદા પૂરી પાડે છે જ્યારે તમે એવી કોઈ વ્યક્તિ સાથે કામ કરતા હોવ કે જેણે પોતાની સારવાર લેવા અંગે નિર્ણય કરવાની ક્ષમતા ગુમાવી દીધી હોય.

તમે કાયદાકીય, બેંકિંગ કે સલાહકારનાં ક્ષેત્રમાં કામ કરતા હોવ તો અધિનિયમ:

- માનસિક ક્ષમતાની બાબતોને હાથ ધરવા એકમએવ ઢાંચાનું નિર્માણ કરી આપે છે અને તે માટેનાં વિવાદોનો નિકાલ કરવા, આરોગ્ય અને કલ્યાણની બાબતોને હાથ ધરવા અને ક્ષમતાની ઉણપ ધરાવતા લોકોની નાણાકીય બાબતોનો નિકાલ કરવા માટે ઉત્તમ પ્રણાલી બનાવે છે.

અધિનિયમ મહત્વપૂર્ણ રક્ષણાત્મક પગલાનું નિર્માણ કરે છે:

- નવા સલામતીના ન્યાયાલય પાસે એવું જાહેર કરવાની સત્તાઓ હશે કે, કોઈ વ્યક્તિમાં ક્ષમતાની ઉણપ છે કે નહીં તથા આવી ઉણપ વાળી ક્ષમતાના વ્યક્તિ વતી વર્તવા અને નિર્ણયો લેવા માટે ઓર્ડર બનાવવા અથવા સહાયકોની નિમણૂક કરવી. ઘણીવાર કોર્ટમાં ગયા સિવાય પણ મુશ્કેલ પરિસ્થિતિઓને હાથ ધરવા માટે બીજા અન્ય રસ્તાઓ હોઈ શકે છે જેમ કે હાલમાં જે કાર્યરત હોય તેવી ફરિયાદ માટેની પ્રક્રિયા પ્રથા.
- એક નવો લોક અધિકારી જેને પબ્લિક ગાર્ડિયન કહેવાય છે જેને અધિનિયમ મુજબની ઘણી ફરજો હશે, જેમ કે LPA ની નોંધણી કાર્ય સહિત કોર્ટ દ્વારા નિયુક્ત સહાયકો પરના નિરીક્ષણનું કાર્ય કરવાનું હોય છે. આ પબ્લિક ગાર્ડિયનને નવા પબ્લિક ગાર્ડિયન કચેરી (OPG) માંથી આ ફરજો બજાવવા માટેની સહાય મળતી રહેશે જે હવે હાલમાં હાજર પબ્લિક ગાર્ડિયન કચેરી (PGO)-નું સ્થાન લેશે.
- ક્ષમતાની ઉણપવાળી વ્યક્તિને ખરાબ સારવાર કે તેના પ્રત્યે જાણીબૂઝીને દાખવેલ બેદરકારીની બાબતને એક નવા ફોજદારી ગુનો

ડિસેમ્બર, 2006 માં પ્રકાશિત કરવામાં આવેલ આચાર સંહિતા નવો કાયદો કેવી રીતે કાર્ય કરશે તે જણાવશે. અધિનિયમ જણાવે છે કે વ્યવસાયિકો અને ચૂકવાતા સંભાળકર્તાઓ, અન્યોની જેમ આચારસંહિતાને માન આપવાનું રહેશે.

હાલની વ્યવસ્થા પર આ અધિનિયમથી શું અસર પડશે?

કોઈકની ક્ષમતાની ઉણપ માટેના તમે પ્રાપ્તિકર્તા હોવ તો:

- એપ્રિલ, 2007 બાદ પણ તમારી સત્તા તમે જાળવી રાખી શકશો પરંતુ તમારી ગણના નવી ન્યાયી સુરક્ષા હેઠળ નિયુક્ત થયેલ સહાયક તરીકેની કહેવાશે. પબ્લિક ગાર્ડિયનશીપ ઓફિસ હાલના બધા જ પ્રાપ્તિકર્તાઓનો સંપર્ક કરશે જેથી જરૂરી વ્યવસ્થા કરી શકાય. તમારે અમારો સંપર્ક કરવાની જરૂર નથી.

તમે એન્ડયુરીંગ પાવર ઓફ એટોર્ની (EPA) બનાવેલ હોય અથવા તમે કોઈના વતીથી EPA હેઠળ કામ કરતા હોવ તો:

- એપ્રિલ, 2007 પછી પણ તે માન્ય ગણાશે, જો હજી નોંધણી નહીં કરાવેલ હોય તો પણ, સિવાય કે જે વ્યક્તિએ આ EPA બનાવી હોય અને તેને રદ કરીને તેને બદલે LPA થી બદલવા માગતો હોય.

એપ્રિલ, 2007 પહેલાં

જો કે આ પ્રકારનાં ફેરફારો તમને કોઈ ક્ષમતાની ઉણપવાળી વ્યક્તિ માટે ભવિષ્યની નાણાંકીય બાબતોનાં પ્રબંધન અંગેના આયોજન માટેના જરૂરી પગલાં લેવાથી અટકાવી નહીં શકે.

ઈમેઈલ: custserv@guardianship.gsi.gov.uk

ટેલીફોન: 0845 330 2900

અથવા ... પર વેબસાઈટની મુલાકાત લો:

www.guardianship.gov.uk

નવા અધિનિયમ અંગેની વધુ માહિતી

2006 ના અંત સુધીમાં અમે, નીચે દર્શાવેલ અધિનિયમથી અસર થતા લોકોના જૂથ માટે વધુ માહિતી આપતી પુસ્તિકાઓ (વિનામૂલ્યે)નું નિર્માણ કરીશું :

1. જેમાં ક્ષમતાની ઉણપ હોય અથવા જે ભવિષ્ય માટે આગોતરું આયોજન ઈચ્છતા હોય તેવા લોકો
2. પરિવાર અને માનદ સંભાળકર્તાઓ
3. આરોગ્ય અને સામાજિક સંભાળમાં ફરજ બજાવતાં કર્મચારીઓ
4. વકીલો અને સલાહકાર કાર્યકરો
5. શીખવાની અશક્તતા ધરાવતા લોકો

જો આપને આ પુસ્તિકા મેળવવાની ઈચ્છા હોય તો વેબસાઈટનાં માધ્યમથી અથવા પુસ્તિકામાં પાછળ જણાવેલ સરનામે અમારો સંપર્ક કરશો, જેમાં તમારે કયા પ્રકારની પુસ્તિકા જોઈએ છે તે જણાવવું. જો તમે અધિનિયમ અંગે અન્ય કોઈ માહિતી ઈચ્છતા હોવ, વિના મૂલ્ય સમાચારપત્રિકા સહિત કે જે કાયદાને કેવી રીતે અમલમાં લાવવો તે વિશે જણાવતી હોય, તો અમારી વેબસાઈટ www.dca.gov.uk/capacity/index.htm પર અમારી મુલાકાત કરો.

સંપર્ક અને માહિતી વિગતો

પોસ્ટ: Mental Capacity Implementation
Programme
Department for Constitutional Affairs
5th floor, Steel House
11 Tothill Street
London
SW1H 9LH

ટેલીફોન: 020 7210 0037/0038

ફેક્સ: 020 7210 0007

ઈ-મેઇલ: makingdecisions@dca.gsi.gov.uk

વેબસાઇટ: www.dca.gov.uk/capacity/index.htm

આ પુસ્તિકા વિનંતી કર્યેથી બીજી ભાષાઓ અને
વૈકલ્પિક ફોર્મેટોમાં ઉપલબ્ધ છે

નવા માનસિક ક્ષમતા અધિનિયમની માહિતી નીચે
દર્શાવેલ સંસ્થા દ્વારા પ્રસ્તુત કરવામાં આવી છે:



Llywodraeth Cynulliad Cymru
Welsh Assembly Government



public
guardianship
office

dca

Department for
Constitutional Affairs
Justice, rights and democracy